



RAN-2501001205030703

T.Y.B.A. (Sem. - V) Examination October - 2025

International Economics - Major (Paper - 16)

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book
- (2) પ્રશ્ન નંબર 1 ફરજિયાત છે.
First question is compulsory
- (3) જમણી બાજુના અંક પ્રશ્નોના પૂરા ગુણ દર્શાવે છે.
Figure to the right indicate full marks of the questions

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

- પ્ર. 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (ગમે તે પાંચ) (10)**
1. આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવાનાં કારણો જણાવો.
 2. વેપારની શરતો એટલે શું?
 3. ઉત્પાદન શક્યતા રેખા એટલે શું?
 4. હેડસર-ઓહલીનનાં સિદ્ધાંતની ધારણાઓ જણાવો.
 5. SAARC અને BRICS નું પુરૂ નામ લખો.
 6. બાળ ઉદ્યોગોનો સંરક્ષણ આપતી વખતે ધ્યાનમાં લેવાનાં મુદ્દાઓ દર્શાવો.
 7. સ્થિર અને અસ્થિર વિનિમય દરનો અર્થ આપો.
- પ્ર. 2. આંતરરાષ્ટ્રીય વ્યાપારનાં લાભો જણાવો, આંતરરાષ્ટ્રીય વ્યાપારનાં લાભોને અસર કરતા પરિબળો અને તેને મહત્તમ બનાવવાની શરતો સમજાવો. (13)**
- અથવા**
- પ્ર. 2. અ. “આંતરરાષ્ટ્રીય વેપાર એ આંતર પ્રાદેશિક વેપારનું જ વિશિષ્ટ સ્વરૂપ છે.” સમજાવો. (07)**
- બ. વેપારની શરતોને અસર કરતાં પરિબળોની ચર્ચા કરો. (06)**
- પ્ર. 3. સંરક્ષણ નીતિ એટલે શું? સંરક્ષણ નીતિની તરફેણ અને વિરૂધ્ધની દલીલો સમજાવો. (13)**
- અથવા**
- પ્ર. 3. અ. વૈકલ્પિક ખર્ચના સિદ્ધાંત સમજાવો. (07)**
- બ. જકાતની વિવિધ અસરો ચર્ચો. (06)**
- પ્ર. 4. ટૂંકનોંધ લખો. (ગમે તે બે) (14)**
1. વેપારની શરતોના પ્રકારો
 2. હેડસર-ઓહલીનનાં સિદ્ધાંતની મર્યાદાઓ.
 3. મુક્ત વ્યાપારનાં લાભો.
 4. સમજરીદ શક્તિનો સિદ્ધાંત

ENGLISH VERSION

- Q. 1 Answer the following questions briefly (any five) (10)**
1. State the reasons for the emergence of international trade.
 2. What is terms of Trade?
 3. What is production possibility curve?
 4. State the assumptions of Heckscher-Ohlin theory.
 5. Write the full name of SAARC and BRICS.
 6. Indicate points taken into account while giving protection to infant industries.
 7. Give the meaning of fixed and flexible exchange rate.
- Q. 2 State the Advantages of international trade. Explain the factors affecting advantages of international Trade and conditions to make it maximum. (13)**
- OR**
- Q. 2 (A) “International trade is a special case of inter regional trade” explain. (07)**
(B) Discuss the factor affecting on terms of Trade. (06)
- Q. 3 What is protection policy? Explain the arguments for and against of protection policy. (13)**
- OR**
- Q. 3 (A) Explain the opportunity cost theory. (07)**
(B) Discuss the various effect of tariff. (06)
- Q. 4 Write short note, (any two) (14)**
1. Type of terms of trade.
 2. Limitation of Heckscher-Ohlin theory.
 3. Advantages of free trade.
 4. Theory of purchasing power parity.
-